

ગોચર વાસચારાનો ખજનો



પશુ વિજ્ઞાન કેન્દ્ર, લીમખેડા
આદિવાસી સંરોધન-વ-તાલીમ કેન્દ્ર
આણંદ ફંઝ યુનિવર્સિટી, દેવગઢ બારીથા - ૩૮૯ ૩૮૦

ગાયોના ચરિયાણ માટે ખાસ સુરક્ષિત રાખવામાં આવેલી જમીનને ખરા અર્થમાં ગૌચર કહેવાય છે. માનવ વસતિ વધારો, ગૌચરના દ્વાણો, સારી જમીનમાં ખેતીના પાકો લેવાના કારણે ગૌચર માટે હવે હલકી, ખાડા ટેકરાવાળી, જગ્ણા-જંખરાવાળી, ધોવાણ થ્યેલી કે ખારવાળી જમીનો બાકી રહી ગઈ છે.

ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યાં બાદ થોડાંક દિવસોમાં તુરત જ કુદરતી રીતે જમીનમાંથી લીલી કુપળો હુંઠીને આણું પાતળું ઘાસ ઉગવા માಡે છે. અગાઉના વરસના પડેલા ઘાસના બી અથવા અન્ય જગ્યાએથી પવનથી ઉડીને આવેલા કે પ્રાણી પક્ષી દ્વારા પડેલા ઘાસના બીજ પાણી અથવા ભેજ મળતા ધરતીની ગોદમાં વિના પ્રયાસે ઉગી નીકળે છે અને જોતજોતામાં ધરતી માતા લીલી સાડી પરીધાન કરીને નવપલ્લવિત થઈ જાય છે. કુદરતનાં આ પ્રયાસોમાં થોડાક અન્ય પ્રયત્નો કરવામાં આવે અથવા તો થોડીક કાળજી લેવામાં આવે તો ગૌચરનું ઉત્પાદન સારા પ્રમાણમાં લઈને તેના સારા લાભ મેળવી શકાય છે.

ગૌચર સુધારણા માટેના પ્રયત્નો અને કાળજી :

- (૧) ગૌચરનું રક્ષણ
- (૨) જમીનમાં પાણી અને ભેજનો સંગ્રહ
- (૩) ગૌચરની ચોમાસા પહેલાની પૂર્વ તૈયારી
- (૪) બીજની પસંદગી, છંટકાવ અને રોપણી
- (૫) ચરિયાણ વ્યવસ્થા

(૧) ગૌચરનું રક્ષણ :

વાડના રક્ષણથી ગૌચરના ઘાસનું રક્ષણ થશે અને રક્ષિત ગૌચરમાં ઘાસનો ઉગાવો સારો થશે તથા ઘાસના મુળીયા જમીનમાં સારી રીતે ઉડી સુધી જશે અને ઘાસ ઉચ્ચ થશે તેથી ચરિયાણ વેળાએ મુન સાથે છોડ ઉખડશે નહીં. કાંટાળી વનસ્પતિ, થોર નફફટવેલથી, બોરડીથી વગેરેથી રક્ષિત વાડ બનાવી શકાય.

(૨) જમીનમાં પાણી અને લેજનો સંગ્રહ :

ગૌચરની જમીન સામાન્ય રીતે ઢોળાવવાળી, ખાડા ટેકરાવાળી, અસમતલ હોય છે. જેથી સારો પાક કે સારુ ઘાસ ઉગી નીકળતું હોતું નથી. જમીનને શક્ય તેટલી સમતલ કરવી અને શક્ય તેટલો વધારે સમય પાણી અથવા લાંબો સમય ભેજ સચયાઈ રહે તેવા પ્રયત્નો કરવા. જેથી વધુ પ્રમાણમાં ઘાસ ઉગી નીકળશે અને ઘાસનો વધુ વિકાસ થઈ લાંબો સમય ઘાસચારો પુરો પાડશે. જે જગ્યાએથી પાણી વેગથી વહેતું હોય ત્યાં વેગ ઘટાડવાના પ્રયત્નો કરવા. ઢોળાવવી જમીનમાં સીંધું પાણી વહી જતું હોય તો આડા નાના નાના ચાસ કરવા અને પાણીને ચાસમાં રોકવું. સમતલ જમીનને બેડવાથી તેના ચાસમાં પાણીનો સંગ્રહ થાય છે અને જમીનમાં ભેજનો સંગ્રહ થાય છે. જે ઘાસ ઉગવા માટે ઘણું જ મહત્વનું છે.

(૩) ચોમાસામાં પહેલાની પૂર્વ તૈયારી :

ચોમાસા પહેલા ગૌચરમાં ઉગેલી નકામી જાડી, જાંખરા અને ઘાસચારા માટે નકામી વનસ્પતિ દૂર કરવી જોઈએ. નકામા પથ્થર પડ્યા હોય તો તે વ્યવસ્થિત ગોઢવી પાણી રોકવા ઉપયોગમાં લેવા. કાંટાવાળી વનસ્પતિને ગૌચર ફરતે કે વચ્ચે બનાવેલ વાડ ઉપર નાંખી વાડ મજબુત બનાવવી.

(૪) બીજની પસંદગી, છંટકાવ અને રોપણી :

ગૌચરમાં મોટે ભાગે ઝીજવો, ધામડા, શાડીયાર, ધરપડો, રાતડ, સામો, ધંઉલુ, ગાંધુ,

(મોશી) જેવા અનાજ વર્ગના ધાસ થાય છે. જાનવરોના પોષણ અને દૂધ ઉત્પાદન માટે સમતોલ આહારજરૂરી છે. એટલા માટે પ્રોટીન વર્ગના ધાસ જેવા કે વેકરીયુ, મગામઠી, સમેરવો, કળથી, શીરાદ્રો પણ ઉગાડવા. શક્ય તેટલા આવા ધાસના બીજે લેવા કરી લેવા જોઈએ અને ગૌચરમાં અન્ય જગયાએ વેરવા જોઈએ. ધાસના બીજી હલકા અને ઊરી જાય તેવા હોય છે. તો આવા બીજને વાવણી માટે છાણ, માટીની નાની નાની ગોળીઓ બનાવી બીજને તેમાં ફેરવવાથી તેની ફરતે બીજ ચોટી જાય છે. આવી ગોળીઓ સુકવીને સાચવવામાં આવે અને વરસાદ પડ્યા બાદ આવી ગોળીઓને જમીનમાં સહેજ દબાવી દેવાથી અથવા ઉપર માટી વાળી દેવાથી બીજનો ઉગાવો સારાં પ્રમાણમાં થાય છે.

(૫) ચરિયાણ વ્યવસ્થા :

ચરિયાણની વ્યવસ્થા માટે ગૌચરના ચાર થી વધુ ભાગ પાડી દેવા જોઈએ. જે પૈકી દર વર્ષ એક ભાગમાં જાનવરને ચરવા દેવા નહીં અને તે ભાગ બીયારણનાં ઉત્પાદન માટે જ સુરક્ષિત રાખવો. બીયારણ કુદરતી રીતે ખરી પડ્યા બાદ ધાસચારાના સૂકા પુણા બનાવવા અથવા સૂકા પુણાને ખંખેરીને બીજ ભેગું કરવું. બીયારણ લીધા બાદ જાનવરોને તેમાં ચરાવવા છોડવા જેથી બીયારણનો જથ્થો દર વર્ષ મહ્યા કરે. બાકીના ભાગમાં વારાફરતી જાનવરોને ચરવા છોડવા જોઈએ. સામાન્ય રીતે છ ઈંચ કરતા વધુ મોટું ધાસ થાય ત્યારે જ જાનવરોને ચરાવવા જોઈએ. બીયારણ માટેનો ભાગ દર વર્ષ બદલતાં જવું. જેથી આખાય ગૌચરમાં બીયારણ ઉપલબ્ધ થઈ શકે.

દરેક ગામમાં ગૌચરની કાળજી રાખવી તેનું જતન કરી પદ્ધતિસર જાનવર ચરાવવામાં આવે તો તમામ જાનવરોને લગભગ આઠ માસ સુધી લીલો ચરિયાણ મળી રહે તેમ છે.

ઉપરના મુદ્દાઓ વાંચી ગામના સમસ્ત ગૌચર માટે વાડ કરવી, તેના ભાગ પાડવા, બેજ સંરક્ષણાના ઉપાયો કરવા વગેરે અધરું જણાય છે. તેથી જ આવી કામગીરી કરવા કોઈ વિચારાતું નથી કે કોઈ આગળ આવતું નથી. પરંતુ આ કામગીરી ખરા અથમાં જરાય અધરી નથી. ગૌચર માટે દરેક ગામે એક ખાસ કમિટીની રચના કરી, તેમાં નિષાધાન માણસોને કામગીરી સોંપવી જોઈએ અને તમામ લોકોએ આ સારી કામગીરીમાં સાથ પુરાવી ખાસ કરીને ચરિયાણ વેળાની વ્યવસ્થા માટે સહકાર આપવો જોઈએ. જયારે નક્કી થાય ત્યારે તે પ્રમાણમાં જ જાનવરો ચરવા છોડવા જોઈએ. ગૌચર ફરતે વાંથી સતત રક્ષણ મળે તે માટે જરૂર જણાય તો ચોકીયાત મુકવા જોઈએ. ગૌચરના જતન માટે તથા ચરિયાણ વ્યવસ્થા માટે ગ્રામજનોને પોતાની મેળે સમજ વિચારીને પોતાના સ્વકાયદા ઘડવા જોઈએ. અને કાયદાના ભંગ માટે દંનાત્મક જોગવાઈ રાખવી જોઈએ.

ગૌચરમાં કચા ધાસ ઉગાડશો :

(૧) ઝીંગવો :

સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. આ ધાસ ઝીંગવાના નામથી ઓળખાય છે. આ ધાસ ૧ મીટરની ઊંચાઈ ધરાવે છે. કાર સામે ટકી શકે છે. રોપણી જૂન-જુલાઈમાં વરસાદ થયે ધરૂ કે મૂળવાળી ફુટથી કરવામાં આવે છે. એક હેક્ટરની રોપણી કરવા માટે ૨ થી ૩ કિલો બીજ ધરૂ ઉછેરવા માટે પૂરતું છે. બીજને જમીનમાં પૂંખીને મિશ્ર કરવું જોઈએ. ધરુની ઊંચાઈ ૧૦-૧૫ સે.મી. થાય ત્યારે ફેરરોપણી કરવી જોઈએ. ગુજરાત મારવેલ ધાસ-૧ સુધારેલીજાત છે. બીજ દ્વારા વાવણી કરેલ ધાસની કાપણી ૮૦-૧૦૫ દિવસે તથા જડીયા દ્વારા રોપણી કરેલ ધાસની પ્રથમ કાપણી ૬૦-૭૫ દિવસે કરવી

જોઈએ. પછીની દરેક કાપણી દોઢ મહિને મળે છે. સૂરી ખેતીમાં ધાસનું ઉત્પાદન હેક્ટારે ૬૦ થી ૮૦ ક્રિન્ટલ, સારા ભેજવાળા વધુ વરસાદવાળા વિસ્તારમાં ૧૦૦ થી ૨૦૦ ક્રિન્ટલ ધાસ હેક્ટારે મળે છે.

(૨) અન્જન ધાસ :

આ પણ ગૌચર માટેનું બહુવર્ષિય ધાસ ઓછા વરસાદવાળા, સખત ગરમીવાળા વિસ્તારમાં થાય છે. પુસા યલો, અન્જન મારવાડ, ધામણ વગેરે અન્જન ધાસની જાતો છે. આ ધાસને રેતાળ, ગોરાહુ, મધ્યમકાળી અને સારા નિતારવાળી જમીન અનુકૂળ આવે છે. ગૌચરની જમીનમાં સારુ થાય છે. વાવણી જૂન-જુલાઈ માસમાં પ્રથમ વરસાદે કરવી. જ્યારે ફેરરોપણી પદ્ધતિમાં જૂનની શરૂઆતમાં ધરવાટિયું તૈયાર કરીને મહિના પછી ફેરરોપણી કરવી જોઈએ. વાવણી ઓરીને પણ કરી શકાય છે. હેક્ટાર ર થી ૩ કિલો બિયારણાની જરૂરિયાત રહે છે. પ્રથમ વર્ષે વાવણી પછી ચાર મહિને એક કાપણી લેવી અને બીજી ત્રણ કાપણી અને તે પછી દરેક વર્ષે છ છ કાપણી લઈ શકાય છે. પિયત વિસ્તારમાં ૪૦૦ થી ૫૦૦ ક્રિન્ટલ લીલાચારાનું ઉત્પાદન મળે છે. ગૌચરમાં ૧૫૦ થી ૨૦૦ ક્રિન્ટલ લીલોચારો મળે છે.

(૩) ધરફ ધાસ :

આ ધાસ પણ બહુ વર્ષિય પ્રકારનું છે. ૧.૫ મીટર જેટલું ઊચુ થાય છે. પાણીની અધ્યત સામે ટકી શકે છે. કુંગરણ, પથરણ અને રેતાળ જમીન માફક આવે છે.

વાવણી બિયારણાથી તેમજ ધરુ તૈયાર કરીને પણ થઈ શકે છે. જ્યારે ધરુ રોપીને વાવણી કરવી હોય તો હેક્ટારે ૪ કિલો બિયારણાનું ધરુ નાખવું પડે છે. મોટા વિસ્તારમાં વાવેતર કરવું હોય તો હેક્ટારે ૪ કિલો બીજ લઈ ભીની માટી સાથે ભેળવી ઉગાદેલા ચાસમાં બીજ હાથથી ઓરીને વાવવું. પ્રથમ વરસાદે વાવણી કરવી.

ધરફ ધાસની પ્રથમ કાપણી ત્રણ મહીને કરવામાં આવે છે. ત્યાર બાદ દરેક કાપણી દોઢ માસે કરવી. આ ધાસ સૂક્કવીને સુક ધાસ તરીકે પણ પશુઓને ખવડાવી શકાય છે.

(૪) શાંખિયાર :

ઉત્તમ પ્રકારનું ધાસ છે. એક થી દોઢ મીટર જેટલું ઊચુ થાય છે. તેના જડીયા ૫૦ થી ૭૫ સે.મી. ઘેરાવાના થાય છે. આ ધાસના પાન લાંબા, સાંકડા અને બરડ હોય છે.

કુંગરણ, કોતર વિસ્તાર તેમજ ઢાળવાળી જમીન અનુકૂળ આવે છે. મોટે ભાગે પડતર અને પથરણ જમીનમાં ઉગે છે. નદીના કોતરોમાં પણ આ ધાસ થાય છે.

આ ધાસનો ઉછેર બીજ તેમજ ધરુ દારા થઈ શકે છે. ચોમાસા પહેલા ૪૫ સે.મી. ના અંતરે ચાસ ખોદી બિયારણ હી થી ર સે.મી. ઊંડાઈએ પડે તે પ્રમાણે વાવી ઉપર માટીવાળી ટેવી અથવા વરસાદ થયા પછી કોદાળીથી ખાડા કરી ખાડા દીઠ ૪-૫ બીજ અથવા બે થી ત્રણ જડિયા રોપવા. ધરુ ઉછેર કરીને પણ રોપણી થઈ શકે છે. ૧૨-૧૫ સે.મી. ઊંચાઈ થાય એટલે રોપણી કરવી. એક હેક્ટારે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૧૦ કિલો ફોઝફરસ આપવો. સુકુ ધાસ મેળવવા માટે ઓકટોબર-નવેમ્બર માસમાં કાપણી કરવી લીલાચારા માટે પ્રથમ કાપણી ૪૫ દિવસે કરવી. ધાસની કાપણી પ થી ૧૦ સે.મી. ઊંચાઈએથી કરવી.

ડૉ. સંજી વહોરા

સહ પ્રાધ્યાપક, પશુ વિજ્ઞાન કેન્દ્ર

આ.કૃ.યુ., દેવગટલારીયા